

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાનતકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

બ્લોક નં. ૧૬ ભોયતળીયે, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૧૦

કેસ નં. ૫૨૯ / ૨૦૧૫

ક્રમાંક કમિ/ અપગ/૨૦૧૫-૧૬/

તા. ૧૨ / ૦૨ / ૨૦૧૬

વાદી:-

શ્રી કુરેશી ફહીમભાઇ ઇલયાસભાઇ,
મોઢેશ્વરી હોલ, નાના તડની વાડી,
જે.કે.વાળો ખાંચો, હાઇકોર્ટ રોડ,
ભાવનગર.

વિરુદ્ધ

પ્રતિવાદી:-

- (૧) શ્રી અબ્દુલભાઇ હમીદભાઇ કુરેશી
- (૨) શ્રી આજમભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૩) શ્રી યુનુસભાઇ ઉર્ફે અબાભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૪) શ્રી હુસેનભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૫) શ્રી સલીમભાઇ અબ્દુલભાઇ કુરેશી
નં. ૧ થી ૫ રહે.- કુરેશી મેન્શન, વડવા માઢીયાફળી, ભાવનગર.
- (૬) શ્રીમતી ફીરાજાબેન અબ્દુલભાઇ તે શિવરાજ મકવાણાના પત્ની
રહે. જમનાકુંડ કોઢીનું ઝાડ પાસે, મહમદી ફલેટ, ત્રીજે માળ, ભાવનગર.
- (૭) શ્રીમતી સલમાબેન અબ્દુલભાઇ કુરેશી તે રફીકભાઇ અબ્દુલરહેમાનના પત્ની
રહે. માઢીયાફળી, વડવા, કુરેશીનો ડેલો, ભાવનગર.
- (૮) શ્રીમતી જાહેદાબેન અબ્દુલભાઇ કુરેશી તે રજાકભાઇ કુરેશીના પત્ની
કુરેશી મેન્શન, વડવા માઢીયાફળી, ભાવનગર.

અરજદાર શ્રી કુરેશી ફહીમભાઇ ઇલયાસભાઇ, મોઢેશ્વરી હોલ, નાના તડની વાડી, જે.કે. વાળો
ખાંચો, હાઇકોર્ટ રોડ, ભાવનગરે તા.૧૮/૧૧/૨૦૧૫ ના રોજથી વિકલાંગ ધારો, ૧૯૯૫ હેઠળ તેઓના પિતા
મહુમ કુરેશી ઇલીયાસ અબ્દુભાઇ તા.૧૨/૦૪/૨૦૧૪ ના રોજ અવસાન થયેલ અને તેઓના દાદા શ્રી

કુરેશી અબ્દુલભાઇ હમીદભાઇની મીલકતમાં ભાગ હીસ્સો વારસાઇ રીતે મેળવવા તેઓના કાકા અને અન્ય સંબંધીઓ સામે ફરીયાદ કરેલ છે.

પ્રસ્તુત કેસ વિકલાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નરશ્રીના કોર્ટ કેસ રજીસ્ટરમાં કેસ નંબર- ૫૨૯/૨૦૧૫ થી નોંધ કરી તા.૭/૧૨/૨૦૧૫ ની મુદત રાખવામાં આવેલ. મુદતે વાદી તથા તેમના માતૃશ્રી તથા એડવોકેટશ્રી હાજર રહેલા, જ્યારે પ્રતિવાદી પક્ષ તરફે કોઇ હાજર રહેલા નહીં. કેસની વધુ મુદત તા.૨૧/૧૨/૨૦૧૫ ની તથા તા.૨૦/૧/૨૦૧૬ ની રાખવામાં આવેલ. સદર મુદતોએ પણ વાદી હાજર રહેલા છે, પરંતુ પ્રતિવાદી ઓ હાજર રહેલા નથી. વાદી ધ્વારા રજુઆત કરવામાં આવેલ છે કે, દિવાનપુરા રોડ, વોરાવાડ, ભાવનગરની તેઓની સંયુક્ત મિલકત તેમના કાકાશ્રીઓએ મેળવી લીધેલ છે અને વાદી તથા તેમના માતૃશ્રીને મિલકતમાંથી દૂર કરી તેમનો હકક-હિસ્સો આપવાનો ઇન્કાર કરેલ છે. પ્રતિવાદી પક્ષે કોઇ હાજર રહેલ ન હોઇ વાદીને થયેલ અન્યાય અંગે કોઇ ચકાસણી કરી શકાયેલ નથી.

ભારતિય વિકલાંગ ધારો, ૧૯૯૫ ની કલમ: ૨(એ) ની જોગવાઇઓ મુજબ વાદી કે પ્રતિવાદીઓનો સમાવેશ વિકલાંગ ધારાની પ્રસ્તુત કાર્યવાહી ચલાવવા માટે થતો ન હોઇ વાદીનો દાવો રદ કરવામાં આવે છે. વાદીએ આ બાબતે કાયદાની અન્ય કોર્ટમાં દાદ મેળવવી જોઇએ, જે ધ્યાને લઇ હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ.

વાદી શ્રી ફહીમભાઇ ઇલીયાસભાઇ કુરેશીએ દાખલ કરેલ દાવા નંબર - ૫૨૯/૨૦૧૫ આ કોર્ટની હુકમત હેઠળ આવતો ન હોઇ આથી આ દાવો રદ કરવા હુકમ કરું છું.

(સંજય નંદન)

કમિશનર ઓફ ધી કોર્ટ.

પ્રતિ ,

(૧) શ્રી કુરેશી ફહીમભાઇ ઇલયાસભાઇ, મોઢેશ્રવરી હોલ, નાના તડની વાડી, જે.કે.વાળો ખાંચો, હાઇકોર્ટ રોડ, ભાવનગર.

- (૨) શ્રી અબ્દુલભાઇ હમીદભાઇ કુરેશી
- (૩) શ્રી આજમભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૪) શ્રી યુનુસભાઇ ઉફે અબાભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૫) શ્રી હુસેનભાઇ અબ્દુલભાઇ કુરેશી
- (૬) શ્રી સલીમભાઇ અબ્દુલભાઇ કુરેશી
નં.૨ થી ૬ રહે.- કુરેશી મેન્શન, વડવા માઢીયાફળી, ભાવનગર.
- (૭) શ્રીમતી ફીરાજાબેન અબ્દુલભાઇ તે શિવરાજ મકવાણાના પત્ની, રહે. જમનાકુંડ કોઠીનું ઝાડ પાસે,
મહમદી ફલેટ, ત્રીજે માળ, ભાવનગર.
- (૮) શ્રીમતી સલમાબેન અબ્દુલભાઇ કુરેશી તે રફીકભાઇ અબ્દુલરહેમાનના પત્ની, રહે. માઢીયાફળી,
વડવા, કુરેશીનો ડેલો, ભાવનગર.
- (૯) શ્રીમતી જાહેદાબેન અબ્દુલભાઇ કુરેશી તે રજાકભાઇ કુરેશીના પત્ની, રહે. કુરેશી મેન્શન,
વડવા, માઢીયાફળી, ભાવનગર.